

LL.B. SEMESTER - 3 (CBCS) Examination
OCT/NOV-2024 (AS PER SYLLABUS YEAR JULY-2024)
Principles of Taxation Law & GST (Core-2024)

Time: 3:00 Hours

Marks: 100

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન.૧ પગારના શિર્ષક હેઠળ કયા પ્રકારની આવકનો સમાવેશ થાય છે? (૨૦)
 અથવા
- પ્રશ્ન.૧ ધંધાની આવકમાંથી બાદ મળતા ગમે તે પાંચ ખર્ચા જણાવો.
- પ્રશ્ન.૨ મૂડી નફો એટલે શું? લાંબાગાળાના અને ટૂંકાગાળાના મુડી નફો આવકવેરામાંથી કેવી રીતે ગણવામાં આવે છે. (૨૦)
 અથવા
- પ્રશ્ન.૨ આકારણી એટલે શું? આકારણીનાં પ્રકારો સમજાવો.
- પ્રશ્ન.૩ આવકવેરા અધિનિયમ હેઠળની કુલ આવકની ગણતરી માટે પ્રક્રિયા સમજાવો. (૨૦)
 અથવા
- પ્રશ્ન.૩ આવક છુપાવવા અંગે દંડની જોગવાઈઓ સમજાવો.
- પ્રશ્ન.૪ GST એટલે શું? GST ના પ્રકારો વિશે ચર્ચા કરો. (૨૦)
 અથવા
- પ્રશ્ન.૪ સપ્લાય (પુરવઠો) GST કાયદા નીચે સવિસ્તાર સમજાવો.
- પ્રશ્ન.૫ ટૂંકનોંધ લખો. (કોઈપણ બે) (૨૦)
- 1) ખેતી વિષયક આવક
 - 2) બક્ષિસવેરો
 - 3) GST કાયદા હેઠળ માલ અને સેવા સમજાવો.
 - 4) GST કાયદા હેઠળ નોંધણી અને ટેક્સ ઈન્વોઈસની સજા સમજાવો.

ENGLISH VERSION

- Que.1 What type of income will fall under the head 'Salary'? Describe it. (20)
 OR
- Que.1 State any five deductions from the expenditure on income of from Business.
- Que.2 What is capital gain? Explain the method of calculation of long term and short-term capital gain under Income Tax Act. (20)
 OR
- Que.2 What is assessment? Explain the kinds of assessment.
- Que.3 Explain the procedure for the computation of total income under Income Tax Act. (20)
 OR
- Que.3 Explain the penalty provision for concealment of income.
- Que.4 What is GST? Discuss in the kinds of GST. (20)
 OR
- Que.4 Explain in detail supply under GST Act.
- Que.5 Write Short Notes. (Any Two) (20)
- 1) Agricultural Income
 - 2) Gift Tax
 - 3) Explain 'Goods and Service' under GST Act
 - 4) Explain penalty provision for Registration and Tax Invoice under GST Act
